

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

બશાઈરુલ ખૈરાત

મુસન્નિફ

સચ્ચિદુના શૈખ અબ્દુલકાદિર જુલાની ગૌષે પાક

رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ

નાશિર

મોહસિને આઝમ મિશન
કિર્તીકુંજ સોસાયટી, શાહેઆલમ ટોલનાકા,
અહમદાબાદ (ગુજરાત)



بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

अशाईरुल जैरात

मुसन्निह

सखिदुना शैभ अब्दुलकादिर जुलानी

गौसे आज़म दस्तगीर رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ

तरजमा और पुक़ रीडिंग

हाज़ु धबाहीमभाई वडीयावाला

टाइप सेटींग

जनाब तोडीक अहमद अशरडी (जौदा)

सिने धशाअत

2024 (चौथी बार)

तअदाद

1000

हदिया

दुआअे जैर

मिलनेका पता

मकतअअे शैभुल-धस्लाम, अलिह किराणाके सामने

रसूलाबाद, शाहे आलम, अहमदाबाद-२८

और मोहसिने आज़म मिशनकी तमाम ढान्थें

कोन्टैकट : 96 24 22 12 12

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ
أَمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا ۝



કા-લલ્લાહુ-તબારક-વ-તઆલા-ફી-શાની-
હબીબિહિલ-કરીમ

ઇન્નલ્લાહ-વ-મલાઇકતહુ-યુસલ્લૂન-અલન્નબિય્યિ-યા
અય્યુહલ્લઝીન-આમનૂ-સલ્લૂ-અલૈહિ-
વ-સલ્લિમૂ-તસ્લીમા ૦



તર્જમા

“બેશક ! અલ્લાહ પાક અને તેના તમામ ફિરિશ્તાઓ
દુરુદ મોકલે છે, તે ગૈબ બતાવનાર (નબી) ઊપર, એ ઈમાન
વાલાઓ ! તેમના ઊપર દુરુદ અને ખૂબ સલામ મોકલો.”

(કન્ઝુલ ઈમાન)

સલ્લલ્લાહુ-અલન-નબિય્યી-ઉમ્મિય્યિલ-કરીમ-વ-આલિહી-
સલ્લલ્લાહુ-તઆલા-અલયહિ-વસલ્લિમ-સલાતંવ-વ-
સલામન-અલયક યા રસૂલલ્લાહ !

دُرُودِ اِبْرَاهِيمَ

اللَّهُمَّ صَلِّ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ وَعَلَى آلِ سَيِّدِنَا مُحَمَّدٍ كَمَا
 صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ سَيِّدِنَا إِبْرَاهِيمَ * إِنَّكَ
 حَمِيدٌ مَّجِيدٌ * اللَّهُمَّ بَارِكْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ وَعَلَى آلِ
 سَيِّدِنَا مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلَى سَيِّدِنَا إِبْرَاهِيمَ وَعَلَى آلِ
 سَيِّدِنَا إِبْرَاهِيمَ * إِنَّكَ حَمِيدٌ مَّجِيدٌ *

અલ્લાહુમ્મ-સલ્લિ-અલા-સચ્ચિદિના-મુહમ્મદિવ-વ-અલા-
 આલિ-સચ્ચિદિના-મુહમ્મદિન-કમા-સલ્લૈત-અલા-
 સચ્ચિદિના-ઇબ્રાહીમ-વ-અલા-આલિ-સચ્ચિદિના-
 ઇબ્રાહીમ-ઇન્નક-હમીદુમ્મજીદ ० અલ્લાહુમ્મ-બારિક-
 અલા-સચ્ચિદિના-મુહમ્મદિવ-વ-અલા-આલિ-સચ્ચિદિના-
 મુહમ્મદિન-કમા-બારકત-અલા-સચ્ચિદિના-ઇબ્રાહીમ-વ-
 અલા-આલિ-સચ્ચિદિના-ઇબ્રાહીમ-ઇન્નક-હમીદુમ્મજીદ ०

اَلسَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ

“અસલામુ-અલૈક-અચ્ચુહન્નબિચ્ચુ
 વ-રહમતુલ્લાહિ-વ-બરકાતુહૂ”

तर्जमा

“સલામ હો આપના ઊપર ઐ નબી ! અને અલ્લાહ પાક ની
 રહમતોં અને બરકતોં આપના ઊપર થાય.”

મહબ્બતે રસૂલ જાને ઇમાન

لَا يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّىٰ
أَكُونَ أَحَبَّ إِلَيْهِ مِنْ وَاَلِدَيْهِ
وَإِلِدَيْهِ وَالنَّاسِ أَجْمَعِينَ ۝

લા-યુઅમિનુ-અહદુકુમ-હત્તા-અકૂન-
અહબ્બ-ઇલૈહિ-મિન-વલદિહી-વ-
વાલિદિહી-વન્નાસિ-અજમઈન ૦

તર્જમા

“હઝરતે અનસ રَضِيَ اللهُ تَعَالَى عَنْهُ થી રિવાયત છે કે હુઝૂરે અકદસ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ઈરશાદ ફરમાવે છે કે તમારા માંથી કોઈ પણ શખ્સ ત્યાં સુધી મુસલમાન નથી થઈ શકતો જ્યાં સુધી તે પોતાની ઔલાદ, માં-બાપ અને બાકીના તમામ લોકો થી વધીને મારાથી મહબ્બત ન કરતો હોય.”

(બુખારી, મુસ્લિમ, અહમદ, તિર્મિઝી, નિસાઈ અને ઇબ્ને માજા)

તમારા જેવો ખૂબ સૂરત કોઈ નથી

وَ أَحْسَنُ مِنْكَ لَمْ تَرَ قَطُّ عَيْنِي

وَ أَجْمَلُ مِنْكَ لَمْ تَلِدِ النِّسَاءُ

خُلِقْتَ مُبَرَّأً مِنْ كُلِّ عَيْبٍ

كَأَنَّكَ قَدْ خُلِقْتَ كَمَا تَشَاءُ

વ-અહસનુ-મિન્કા-લમ-તરા-કતુ-એની

વ-અજમલુ-મિન્કા-લમ-તલિદિન-નિસાઉ

ખુલિકત-મુબર્રઅન-મિન-કુલ્લિ-એબિન

ક-અન્નક-કદ-ખુલિકત-કમા-તશાઉ

તર્જમા

“બેશક ! આપનાથી વધીને ખૂબ સૂરત શખ્સ મારી આંખોંએ કદી જોયો જ નથી અને આપના થી વધીને સૌદર્યવાન ને કદી કોઈ સ્ત્રીએ જન્મ નથી આપ્યો, આપ દરેક ખામી થી એવા પાક અને સાફ છો કે જાણે તમો તમારી ઈચ્છા મુજબ જ જન્મયા છો”

દુરૂદ શરીફ ની ફઝીલત

“હઝરતે ઉબય ઇબ્ને કા'બ رضي الله تعالى عنه રિવાયત કરે છે કે :- એક વખત મેં હુઝૂરે અકદસ صلى الله تعالى عليه وآله وسلم થી અર્ઝ કરી કે યા રસૂલલ્લાહ ! હું આપના ઊપર વધૂ સંખ્યામા દુરૂદ શરીફ પઢવા ઇચ્છુ છું. આપ સુચન કરો કે મેં મારા માટે દુઆ કરવા માટે જેટલો સમય નક્કી કર્યો છે, તેમાંથી કેટલો સમય આપના ઊપર દુરૂદ મોકલવા માટે નિયુક્ત કરું ? આપે ફરમાવ્યું કે જેટલી તમારા મનની ઇચ્છા હોય, મેં અર્ઝ કરી કે શું ચૌથો (૧/૪) ભાગ નક્કી કરું ? આપે ફરમાવ્યું કે જેટલું તમારૂ મન ચાહે અને જો તેનાથી વધુ સમય ફાળવો તો તમારા માટે ઉત્તમ છે. મેં અર્ઝ કરી કે અરઘો (૧/૨) સમય નક્કી કરું ? આપે ફરમાવ્યું કે જેટલું તમારૂ મન ચાહે અને જો તેનાથી વધુ સમય ફાળવો તો તમારા માટે ઉત્તમ છે. મેં અર્ઝ કર્યું કે તો પછી બે-તૃત્યાંસ (૨/૩) સમય નક્કી કરું છુ આપે ફરમાવ્યું કે જેટલું તમારૂ મન ચાહે અને જો તેનાથી વધુ સમય ફાળવો તો તમારા માટે ઉત્તમ છે. મેં અર્ઝ કરતા કહ્યું કે ઠીક છે, તો હવે હું મારી દુઆનો બધો સમય આપના ઊપર દુરૂદ મોકલવા માટે નક્કી કરું છું, આપ صلى الله تعالى عليه وآله وسلم ફરમાવ્યું કે આ તમારા દીન અને દુન્યાના તમામ મક્સદો પૂરા કરવા માટે કાફી છે અને તમારા ગુનાહોં માફ થઈ જશે.” (હવાલો :- તિર્મિઝી શરીફ)

બશાઈરુલ ખૈરાત ની ફઝીલત

તમામ પ્રસંશા તે મહાન અલ્લાહ તબારક વ તઆલા માટે છે, જેણે ઈમાનની અમુલ્ય દૌલત આપણને અર્પણ ફરમાવીને આપણા ઊપર મહાન ઉપકાર કર્યો અને દરેક પળ અને દરેક ક્ષણ દુરુદો સલામ સરવરે દો જહાં, મુખ્તારે કુલ નબી صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ઊપર અને આપના પવિત્ર વંશ અને બધા નિજાવાન સાથીઓ ઊપર.

શૈખુલ ઉમ્મત, ઈમામુલ અઈમ્મા, તમામ વલિયોના સરદાર, કુત્બુલ અક્તાબ, ગૌસુલ આ'ઝમ હઝરતે સય્યિદુના અબ્દુલ કાદિર જીલાની બગદાદી رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ એ આપની મહેફીલમાં કાયમી ધોરણે બેસનારા નિઃસ્વાર્થ અનુયાયીઓ થી ફરમાવ્યું કે મારા થી તે દુરુદ લો (શીખો) જે મેં ઇલ્હામ (પ્રેરણા) દ્વારા અલ્લાહ પાક થી મેળવ્યું છે. મેં આ મુબારક દુરુદ શરીફ ને નબિયે કરીમ સરવરે કાઈનાત صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ની બારગાહે આલીમાં પેશ કરીને એવો ઈરાદો કર્યો કે હુઝૂરે અકદસ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ થી આ દુરુદ શરીફની ફઝીલત જાણું..પણ..મારો સવાલ હું પૂછું, તે પહેલા જ આપે ઈરશાદ ફરમાવ્યો કે આ દુરુદની ઘણી ફઝીલત છે. જેની ગણતરી કરવી અશક્ય છે. (અમુક ફઝીલતો અહીં રજૂ કરવામાં આવે છે)

★ આ દુરુદ શરીફ પઢનારના દરજ્જાઓ બુલન્દ થાય છે અને તેના તમામ જાઈઝ મક્સદો પૂરા થાય છે .

★ આ દુરુદ શરીફ પઢીને જે પણ જાઈઝ મક્સદનો ઈરાદો કરશે, તે કદી રદ નહીં થાય અને નિરાશા નહીં સાંપડે અને તેનો વિસ્વાસ કદી પણ નહીં ડગમગે અને તેની દુઆ કબૂલ થશે.

★ જે શખ્સ આ દુરુદ શરીફ પઢશે, ભલે ફકત એક વખત જ પઢે અથવા આ દુરુદ અદબની સાથે ઉંચકીને ચાલે, તો અલ્લાહ પાક તેને અને તેની મજલિસમાં જે પણ ઉપસ્થિત હશે, તે બધાને પોતાના ફઝ્લો કરમ થી બખ્શી દેશે.

★ આ દુરુદ શરીફ હમેશા નિયમિત પઢનારની મૌતનો સમય જ્યારે પણ આવશે, ત્યારે તેની પાસે ચાર ફિરિશ્તા આવશે, પહેલો ફિરિશ્તો તેની પાસે શૈતાનને આવતા રોકી દેશે. બીજો ફિરિશ્તો તેને કલમએ શહાદતની તલ્કીન કરશે એટલે કે શિખવશે. ત્રીજો ફિરિશ્તો તેને જામે કૌસર પીવડાવશે. ચૌથો ફિરિશ્તાના હાથમાં સોનાનું વાસણ હશે, જેમા જન્નતના ફળો હશે, તે ફિરિશ્તો તેને જન્નતના તે સ્થળની બશારત (ખુશ ખબરી) આપશે અને કહેશે કે ઐ અલ્લાહના બન્દા ! ખુશ થઈ જા ! તે જન્નતમા તારું સ્થાન તારી સગી આંખે તારી રૂહ નિકળતા પહેલાં જોઈ લીધું તે શખ્સ પોતાની કબ્રમાં એકદમ નિરાંત, આનંદ અને ખુશીની સાથે દાખિલ થશે, તેને કબ્રની તંગી અને કષ્ટનો ભય નહીં લાગે. તેની કબ્રમાં રહેમતના ચાલીસ દરવાઝાઓ ખોલી નાખવામાં આવશે, ઉપરાંત નૂર અને રૌશનીના દરવાઝાઓ પણ ખોલી નાખવામાં આવશે અને તેની કબ્ર નૂર થી ઝળહળી ઉઠશે. (ઈન્શાઅલ્લાહ)

કોના માટે આ બધું છે ?

રિવાયત

હુઝૂરે અકદસ રહમતે આલમ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ થી

રિવાયત કરવામાં આવ્યું છે કે :-

“જ્યારે આપે મે’રાજની રાત્રે આસ્માનો, જન્નત, અર્શ વગેરેની સૈર ફરમાવીને અલ્લાહ પાક ની સમીપતા પ્રાપ્ત કરી, ત્યારે અલ્લાહ પાકે પુછ્યું કે ઐ મહબૂબ ! આ ધરતી કોની છે ? હુઝૂરે અકદસ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ જવાબમાં અર્ઝ કરી કે ઐ રબ ! તારા માટે છે, ફરી સવાલ થયો, ઐ મહબૂબ ! આ હિજાબાત (પદ્મિઓ / ભેદો) કોના માટે છે ? જવાબમાં અર્ઝ કરતાં કહ્યું કે ઐ રબ ! આ તારા માટે છે, ફરી અલ્લાહ પાકે સવાલ પુછ્યો કે કુર્સી કોના માટે છે ? ત્યારે હુઝૂરે અકદસ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ મેં પોતાના સર મુબારકને સજદામાં ઝુકાવી દીધો અને વિશેષ કંઈ કહેવામાં અદબના શિષ્ટાચારે બોલવાથી અટકી ગયા, તે વખતે ખુદ અલ્લાહ પાકે ઈરશાદ ફરમાવ્યો કે ઐ મહબૂબ ! તૂ તેના માટે છે, જે તારા ઊપર દુરુદ મોકલે છે અને તારી અઝમત અને બુઝુર્ગીને વધારે છે.”

બશાઈરુલ ખૈરાત

ની તિલાવત કરતાં પહેલા આ દુઆ પઢવી.

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

اللَّهُمَّ إِنِّي نَوَيْتُ بِصَلَاتِي عَلَى النَّبِيِّ

صَلَاةً عَلَيْكَ صَلَاةً عَلَيْكَ أَمْتِثَالاً لِأَمْرِكَ وَتَعْظِيماً

لِنَبِيِّكَ سَيِّدِنَا مُحَمَّدٍ صَلَاةً عَلَيْكَ

فَتَقَبَّلْهَا مِنِّي بِفَضْلِكَ وَاحْسَانِكَ

وَازِلْ حِجَابَ الْغَفْلَةِ عَن قَلْبِي

وَاجْعَلْنِي مِنْ عِبَادِكَ الصَّالِحِينَ 0

અલ્લા
હુમ્મ-ઘન્ની-નવયતુ-
બિ-સલાતી-અલન્નબિચિય
صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ઘમ્તિસાલન-લિ-
અમરિ-ક-વ-તઅ-ઝીમન-લિ-નબિચિય-
ક-સચ્ચિદિના-મુહમ્મદિન صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ
ફ-તકબ્બલ-હા-મિન્ની-બિ-ફદ-લિક-વ-
ઘહ-સાનિ-ક-વ-અઝિલ-હિજબલ-
ગફ-લતિ અન-કલ્બી-વજ-અલ્ની-
મિન-ઘબાદિક્સસાલિહીન ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! મેં નબિચ્યે કરીમ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ઊપર દુરૂદ મોકલવાની નિચ્ચત તારા હુકમને અનૂસરીને અને અમારા સરદાર હઝરતે સચ્ચિદુના મુહમ્મદ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ની તા'ઝીમ માટે કરી છે. ઐ અલ્લાહ પાક ! તારા ફઝ્લ અને અહેસાન થી કબૂલ ફરમાવ અને મારા દિલ ઊપર થી ગફલતના પદ્મો હટાવીને મને તારા નેક બન્દાઓમાં થી બનાવી દે.” (આમીન યા રબ્બલ આલમીન !)

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ

અલ-હમ્દુ-લિલ્લાહિ રબ્બિલ-આ-લમીન

اَللّٰهُمَّ صَلِّ وَسَلِّمْ عَلٰى سَيِّدِنَا مُحَمَّدٍ

اَلْبَشِيْرِ الْمُبَشِّرِ لِلْمُؤْمِنِيْنَ بِمَا قَالَ

اَللّٰهُ الْعَظِيْمُ : ۝ وَاَنَّ اَللّٰهَ لَا يُضِيْعُ

اَجْرَ الْمُؤْمِنِيْنَ ۝

અલ્લાહુમ્મા-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
સચ્ચિદિના-મુહમ્મદિ-નિલ-ખશીરિલ-મુ-
ખશ્શિરિ-લિલ-મુઅમિનીન-ખિમા-કા-
લલ્લાહુલ-અઝીમુ-વ-ખશ્શિરિલ-
મુઅમિનીન ૦ વ-અન્નલ્લાહ-લા-યુદીઉ-
અજ-રલ મુઅમિનીન ૦

तर्जमा

“अे अल्लाह पाक ! हमारे सरदार हजरत सय्यिदुना मुहम्मद صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ पर दुरद भेज, जो मुअमिनो के लिये भुश भबरी देने और पलुंयाने वाले हैं. जैसा के अजमत वाले अल्लाह पाक का धरशाह है के ० “और धमान वालों को भुश भबरी दो” ० “और बेशक ! अल्लाह पाक नेकों का भदला जाअे नहीं करता ०”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِذَلِكَ كَرِيمٍ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ :

فَاذْكُرُونِي أَذْكَرْكُمْ ۝ اذْكُرُوا اللَّهَ ذِكْرًا كَثِيرًا ۝

وَسَبِّحُوهُ بُكْرَةً وَأَصِيلًا ۝ هُوَ الَّذِي يُصَلِّيْ عَلَيْكُمْ

وَمَلَائِكَتُهُ لِيُخْرِجَكُمْ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ وَ

كَانَ بِالْمُؤْمِنِينَ رَحِيمًا ۝ تَحِيَّتُهُمْ يَوْمَ يَلْقَوْنَهُ

سَلَامٌ وَأَعَدَّ لَهُمْ أَجْرًا كَرِيمًا ۝

અલ્લા
હુમ્મ-સલ્લિ-
વસ્સલિમ-અલા-સચ્ચિદિના-
મુહમ્મદિ-નિલ બશીરિલ-મુબશ્શિરિ-
લિમ્મ્મકિરીન-ઊમા-કા-લલ્લાહુલ-
અઝીમ : ફઝ-કુરુની અઝ-કુર-કુમ ૦ ઉઝ-
કુરુલ્લાહ-ઝિક-રન-કસીરા ૦ વ-સલ્લિહૂહુ-
બુક-રતંવ-વ-અસીલા ૦ હુ-વલ્લઝી-યુસલ્લી-
અલય-કુમ-વ-મલાઈક-તુહુ લિયૂખ-રિ-જકુમ
મિનમ્મુલુમાતિ ઘલન્નૂરિ-વ-કાન બિલ-
મુઅમિનીન-રહીમા ૦ તહિય્યતુહુમ-
યૌમ-યલ-કૌ-નહુ સલામુન-વ-
અઅદ્-દલહુમ-અજ-રન-
કરીમા ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સચ્ચિદુના
મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો ઝિક કરને વાલોં
કો ખુશ ખબરી સુનાને વાલે ઓર ખુશ ખબરી પહુંચાને વાલે
હે. જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઇરશાદ હૈ ૦ “તો
મેરી યાદ કરો, મેં તુમ્હારા ચર્યા કરુંગા” ૦ “અલ્લાહ પાક કો

अहुत याद करो और सुब्बो शाम उस की पाकी बोवो”
 ० “वोडी है के दुइद तेजता है तुम पर वोड और उस के
 फिरिश्ते के तुम्हें अन्धेरियों से उजाले की तरफ निकालें और
 वोड मुसलमानों पर महेरबान है” ० “उन के लिये मिलते
 वक्त की दुआ सलाम हैं और उन के लिये ँज़्जत का सवाब
 तय्यार रभा है ०”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْبَشِيرِ لِلْعَامِلِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ :

أَنْتِ لَا أُضِيعُ عَمَلَ عَامِلٍ مِنْكُمْ مِنْ ذَكَرٍ أَوْ

أُنْثَى ۝ وَبِمَا قَالَ ۝ وَمَنْ عَمِلَ صَالِحًا مِنْ

ذَكَرٍ أَوْ أُنْثَى وَهُوَ مُؤْمِنٌ فَأُولَئِكَ يَدْخُلُونَ

الْجَنَّةَ يُرْزَقُونَ فِيهَا بِغَيْرِ حِسَابٍ ۝

અલ્લા
હુમ્મ-સલ્લિ-વ-
સલ્લિમ-અલા-સય્યિદિના-
મુહમ્મદિ-નિલ-બશીરિલ-મુબશ્શિરિ
લિલ-આમિલીન-બિમા-કા-લલ્લાહુલ-
અઝીમ : અન્ની-લા-ઉદીઉ-અમલ-
આમિલીમ-મિન્કુમ-મિન-ઝકરિન-અવ-
ઉન્સા-વ-બિમા-કાલ : વ-મન-અમિલ-
સાલિહન-મિન-ઝકરિન-અવ-ઉન્સા-વ-
હુવ-મોમિનુન-ફ-ઉલાઘક-યદ
પુલૂનલ-જન્નત-યુરઝકૂન-
ફીહા-બિગૈરિ-હિસાબ ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સય્યિદુના મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો અમલ કરને વાલોં કો ખુશ ખબરી દેને વાલે હૈ, જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ૦ “મૈં તુમ મેં કામ કરને વાલે કી મહેનત અકારત નહીં કરતા મદ હો યા ઔરત” ૦ “ઔર જો અચ્છા કામ કરે મદ ખ્વાહ ઔરત ઔર હો મુસલમાન તો વોહ જન્નત મેં દાખિલ કિયે જાએંગે વહાં બે ગિનતી રિઝ્ક પાએંગે ૦”

اَللّٰهُمَّ صَلِّ وَسَلِّمْ عَلٰى سَيِّدِنَا مُحَمَّدٍ

اَلْبَشِيْرِ الْمُبَشِّرِ لِلاَّوَابِيْنِ بِمَا قَالَ اللهُ

اَلْعَظِيْمُ : فَاِنَّهٗ كَانَ لِلاَّوَابِيْنِ غُفُوْرًا ۝

لَهُمْ مَّا يَشَاءُوْنَ عِنْدَ رَبِّهِمْ ذٰلِكَ جَزَآءُ

اَلْمُحْسِنِيْنَ ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
મુબશ્શિરિલ-અવ્વાબીન-બિમા-કા-
લલ્લાહુલ-અઝીમુ : ઈ-ઇન્નહુ-કાન-લિલ
અવ્વાબીન-ગફૂર ૦ લહુમ-મા-યશાઉન-
ઇન્દ-રબ્બિહિમ-ઝાલિક-જઝાઉલ-
મુહ-સિનીન ૦

तर्जमा

“अै अल्लाह पाक ! हभारे सरदार हजरते सय्यिदुना मुहम्मद ﷺ पर दुरुद भेज, जो तौबा करने वालों को भुश भबरी देने वाले हैं, जैसा के अजमत वाले अल्लाह पाक का ँरशाद है के ० “तो भेशक ! वोह तौबा करने वालों को भभशने वाला है” ० “उन के लिये है जो वोह याहे अपने रब के पास नेकों का येही सिला (भदला) है ०”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ
 الْمُبَشِّرِ لِتَتَّوَابِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ :
 إِنَّ اللَّهَ يُحِبُّ التَّوَابِينَ وَيُحِبُّ الْمُتَطَهِّرِينَ ۝
 وَهُوَ الَّذِي يَقْبَلُ التَّوْبَةَ عَنْ عِبَادِهِ
 وَيَعْفُو عَنِ السَّيِّئَاتِ ۝

અલ્લા
હુમ્મ-સલ્લિ-વ-
સલ્લિમ-અલા-સચ્ચિદિના-
મુહમ્મદિનિલ-બશીરિલ-મુબશ્શિરિ-
લિતવ્વાબીન-બિમા-કા-લલ્લાહુલ-
અમીમ : ઇબ્નલ્લાહ યુહિબ્બુતવ્વાબીન-
વ-યુહિબ્બુલ-મુત-તહિહરીન ૦ વ-
હુવલ્લમી-ચક-બલુતૌબત-અન-
ઇબાદિહિ-વ-ચઅ-ફૂ-
અનિસ્સચ્ચિઆતિ ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સચ્ચિદુના મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો બહુત તૌબા કરને વાલોં કો ખુશ ખબરી દેને વાલે હૈં, જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ૦ “બેશક ! અલ્લાહ પાક પસન્દ રખતા હૈ, બહુત તૌબા કરને વાલોં કો ઔર પસન્દ રખતા હૈ સુથરોં કો” ૦ “ઔર વોહી હૈ જો અપને બન્દોં કી તૌબા કબૂલ ફરમાતા હૈ ઔર ગુનાહોં સે દર ગુઝર ફરમાતા હૈ.”

اَللّٰهُمَّ صَلِّ وَسَلِّمْ عَلٰى سَيِّدِنَا مُحَمَّدٍ

اَلْبَشِيْرِ الْمُبَشِّرِ الْمُخْلِصِيْنَ بِمَا قَالَ اللهُ

اَلْعَظِيْمُ : فَمَنْ كَانَ يَّرْجُو اِلْقَاءَ رَبِّهِ

فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ

رَبِّهِ اَحَدًا ◦ مُخْلِصِيْنَ لَهُ الدِّيْنَ ◦

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
સચ્ચિદિના-મુહમ્મદિનિલ બશીરિલ-
મુબશ્શિરિ-લિલ-મુખ્લિસીન-બિમા-કા-
લલ્લાહુલ અઝીમ : ફ-મન-કાન-ચરખૂ-
લિકાઅ-રબ્બિહી-ફલ-ચઅ-મલ-અમલન-
સાલિહંવ-વલા-યુશ-રિક-બિઘબાદતિ-
રબ્બિહી-અહદા ◦ મુખ્લિસીન-લહુદીન ◦

तर्जमा

“अै अल्लाह पाक ! हमारै सरदार हजरते सय्यिदुना मुहम्मद ﷺ पर दुइद भेज, जो मुज्लिसों के लिये भुश भबरी देने वाले हें, जैसा के अजमत वाले अल्लाह पाक का धरशाद है के ० “तो जिसे अपने रब से मिलने की उम्मीद हो, उसे याहिये के नेक काम करे और अपने रब की बन्दगी में किसी को शरीक न करे” ० “निरे उस के बन्दे हो कर ०”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ

الْبَشِيرِ الْمُبَشِّرِ لِلْمُصَلِّينَ بِمَا قَالَ اللَّهُ

الْعَظِيمُ: ۞ وَأَقِمِ الصَّلَاةَ إِنَّ الصَّلَاةَ

تَنْهَى عَنِ الْفَحْشَاءِ وَالْمُنْكَرِ ۝ أَقِمِ

الصَّلَاةَ وَأْمُرْ بِالْمَعْرُوفِ وَأَنْهَ عَنِ

الْمُنْكَرِ وَأَصْبِرْ عَلَى مَا أَصَابَكَ إِنَّ ذَلِكَ

مِنْ عَزْمِ الْأُمُورِ ۝

અલ્લા
હુમ્મ-સલ્લિ-વ
સલ્લિમ-અલા-સય્યિદિના-
મુહમ્મદિનિલ-બશીરિલ-મુબશ્શિરિ-
લિલ-મુસલ્લીન-બિમા-કા-લલ્લાહુલ-
અઝીમ : વ-અકિમુસ્સલાહ ૦
ઇન્નસ્સલાત-તન્હા-અનિલ-ફહશાઘ-વલ-
મુન્કર ૦ અકિમિસ્સલાત વઅ-મુર-બિલ
મઅરફિ-વન્હા-અનિલ-મુન્કરિ-
વસ્બિર-અલા-મા-અસાબકા-
ઇન્ના-ઝાલિકા-મિન-અઝ
મિલ-ઉમૂર ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સય્યિદુના મુહમ્મદ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ પર દુરૂદ ભેજ, જો નમાઝ પઢને વાલોં કો ખુશ ખબરી દેને વાલે હૈં, જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ૦ “ઔર નમાઝ કાઈમ રખ” ૦ “બેશક ! નમાઝ મન્અ કરતી હૈ બે હયાઈ ઔર બુરી બાત સે” ૦ “નમાઝ કાઈમ રખ ઔર અચ્છી બાત કા હુકમ દે ઔર બુરી બાત સે મન્અ કર ઔર જો ઉફતાદ (મુસીબત) તુઝ પર પળે, ઉસ પર સબ્ર કર. બેશક ! યેહ હિમ્મત કે કામ હૈ ૦”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ

الْبَشِيرِ الْمُبَشِّرِ لِلْخَاشِعِينَ بِمَا قَالَ

اللَّهُ الْعَظِيمُ: ۞ وَاسْتَعِينُوا بِالصَّبْرِ

وَالصَّلَاةِ وَإِنَّهَا لَكَبِيرَةٌ إِلَّا عَلَى الْخَاشِعِينَ

الَّذِينَ يَظُنُّونَ أَنَّهُمْ مُلْقُوا رَبَّهُمْ

وَأَنَّهُمْ إِلَيْهِ رَاجِعُونَ ۞ الَّذِينَ يَذُكُرُونَ

اللَّهُ قِيَامًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِهِمْ وَيَتَفَكَّرُونَ

فِي خَلْقِ السَّمَوَاتِ وَالْأَرْضِ رَبَّنَا مَا

خَلَقْتَ هَذَا بَاطِلًا سُبْحَانَكَ فَقِنَا عَذَابَ النَّارِ ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
 સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
 મુબશ્શિરિ-લિલ-ખાશિઈન-બિમા-કા-
 લલ્લાહુલ-અઝીમ : વસ્તઈનુ-બિસ્સબ-રિ-
 વસ્સલાતિ-વ-ઇન્નહા-લ-કબીરતુન-ઇલ્લા-
 અલલ-ખાશિઈન ૦ અલ્લઝીન-યમુન્નૂન-
 અન્નહુમ-મુલાફૂ-રબ્બિહિમ-વ-અન્નહુમ-
 ઇલયહિ-રાજિબિન ૦ અલ્લઝીન-યઝ-
 ફુર્રનલ્લાહ-કિયામંવ-વ-ફુઉદંવ-વ-અલા-
 જુનૂબિહિમ-વ-યતફ્ફર્રન-ફી-
 ખલ્કિસ્સમાવાતિ-વલ-અદ-રબ્બના-મા-ખલ-
 કત-હાઝા-બાતિલન-સુબ્હાનક-
 ફ-કિના-અઝાબન્નાર ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સચ્ચિદુના મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો આજિઝી કરને વાલોં કો ખુશ ખબરી દેને વાલે હૈં. જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ૦ “ઐ સબ્ર ઐર નમાઝ સે મદદ ચાહો ઐર બેશક ! નમાઝ ઝરૂર ભારી હૈ મગર ઉન પર ભારી નહીં જો રબ કે હુઝૂર ગિળગિળાતે હૈ” ૦ “જિન્હેં યકીન હૈં કે ઉન્હેં અપને રબ સે મિલના હૈ ઐર ઉસી કી તરફ ફિરના

हे” ० “जे अल्लाह की याद करते हैं भणे और बैठे और करवट पर लेटे और आस्मानों और जमीन की पैदाईश में गौर करते हैं. और रब हमारे ! तू ने ये सब बेकार न बनाया. पाकी है तुझे, तू हमें दोऊप के अजाब से बचा ले ०”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِلصَّابِرِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ: ائِمَّا

يُوفَى الصَّابِرُونَ أَجْرَهُمْ بِغَيْرِ حِسَابٍ ० أَوْلِيكَ

الَّذِينَ هَدَاهُمُ اللَّهُ وَأَوْلِيكَ هُمْ أَوْلُوا الْأَلْبَابِ ०

अल्लाहुम्म-सल्लि-व-सल्लिम-अला-
सय्यिदिना-मुहम्मदिनिल-भशीरिल-
मुभशिशिरि-लिस्साभिरीन-बिमा-का-
लल्लाहुल-अमीम : धन्नमा-
युपङ्कस्साभिइन-अज-रहुम-भिगैरि-
हिसाब ० उलाधकल्लमीन-हदाहुमुल्लाहु-
व-उलाधक-हुम-उलुल-अल्लाह ०

तर्जमा

“अै अल्लाह पाक ! हमारै सरदार हजरते सय्यिदुना मुहम्मद ﷺ पर दुरुद भेज, जो सभ्र करने वालों को भुश भबरी देने वाले हैं. जैसा के अजमत वाले अल्लाह पाक का ँरशाद है के ० “साबिरों ही को उन का सवाभ त्तरपूर दिया जाअेगा, बे गिनती” ० “येह है जिन को अल्लाह ने ँदियात इरमाँ और येह हैं जिन को अकल है ०”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ

إِلْبَشِيرِ الْمُبَشِّرِ لِلْخَائِفِينَ بِمَا قَالَ

اللَّهُ الْعَظِيمُ : ۞ وَلِمَنْ خَافَ مَقَامَ

رَبِّهِ جَنَّاتٍ ۞ وَأَمَّا مَنْ خَافَ مَقَامَ

رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ فَيَأْتِي

الْجَنَّةَ هِيَ الْمَأْوَىٰ ۞

અલ્લાહુમ્મ-સલ્લિ-
વ-સલ્લિમ-અલા-સચ્ચિદિના-
મુહમ્મદિનિલ-બશીરિલ-
મુબશ્શિરિ-લિલ-ખાઘફીન-બિમા-કા-
લલ્લાહુલ-અઝીમ : વ-લિમન-ખાફ-
મકામ-રબ્બિહી-જન્નતાન ૦ વ-અમ્મા-
મન-ખાફ-મકામ-રબ્બિહી-વ-ન-
હન્નફ્સ-અનિલ-હવા ૦ ફ-
ઇન્નલ-જન્નત-હિયલ
માઅવા ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સચ્ચિદુના મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો ડરને વાલોં કો ખુશ ખબરી દેને વાલે હૈ જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઇરશાદ હૈ કે ૦ “ઔર જો અપને રબ કે હુઝૂર ખળે હોને સે ડરે, ઉસ કે લિએ દો જન્નતેં હૈં” ૦ “ઔર વોહ જો અપને રબ કે હુઝૂર ખળે હોને સે ડરા ઔર નફ્સ કો ખ્વાહિશ સે રોકા, તો બેશક ! જન્નત હી ઠિકાના હૈ ૦”

اَللّٰهُمَّ صَلِّ وَسَلِّمْ عَلٰى سَيِّدِنَا مُحَمَّدٍ

اَلْبَشِيْرِ الْمُبَشِّرِ لِمُتَّقِيْنَ بِمَا قَالَ اللهُ

اَلْعَظِيْمُ : ۞ وَرَحْمَتِيْ وَسِعَتْ كُلَّ شَيْءٍ

فَسَاكُتْهَا الَّذِيْنَ يَتَّقُوْنَ وَيُوْتُوْنَ الزَّكٰوةَ

وَالَّذِيْنَ هُمْ بِاٰيٰتِنَا يُؤْمِنُوْنَ ۝ الَّذِيْنَ يَتَّبِعُوْنَ

الرَّسُوْلَ النَّبِيَّ الْاُمِّيَّ ۝ فَاُولٰٓئِكَ لَهُمْ جَزَاؤُ

اَلضَّعْفِ بِمَا عَمِلُوْا وَهُمْ فِي الْغُرُفٰتِ اٰمِنُوْنَ ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
સય્દિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
મુબશ્શિરિ-લિલ-મુતકિય્થિન-બિમા-
કા-લલ્લાહુલ-અમીમ : વ-રહમતી-
વસિઅત-કુલ્લ-શૈઈન-ફ-સઅકતુબુહા-
લિલ્લમીન-યતકૂન-વ-યુઅતૂનમ્મકાત-

વલ્લઝીન-હુમ-બિઆયાતિના-
 યુઅમિનૂન ૦ અલ્લઝીન-
 યત્તબિઊનર્સૂલન્નબિય્ચિલ-
 ઉમ્મિય્ચિ ૦ ફ-ઉલાઘક-લહુમ-જઝાઉદિઅ-
 ફિ-બિમા-અમિલુ-વહુમ-
 ફિલ-ગુરુફાતિ-આમિનૂન ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સય્યિદુના મુહમ્મદ ﷺ પર દુરૂદ ભેજ, જો પરહેઝગાર લોગોં કો ખુશ ખબરી દેને વાલે હૈં, જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈં કે ૦ “ઔર મેરી રહમત હર ચીઝ કો ઘેરે હૈ, તો અન્કરીબ મૈં ને’મતોં કો ઉન કે લિયે લિખ દુંગા, જો ડરતે ઔર ઝકાત દેતે હૈં ઔર હમારી આયતોં પર ઈમાન લાતે હૈં” ૦ “વોહ જો ગુલામી કરેંગે ઉસ રસૂલ બે પઢે ગૈબ કી ખબરેં દેને વાલે કી” ૦ “ઉન કે અમલ કા બદલા ઔર વોહ બાલા ખાનોં મેં અમ્નો અમાન સે હૈ ૦”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِلْمُخْبِتِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ : وَبَشِّرِ

الْمُخْبِتِينَ الَّذِينَ إِذَا ذُكِرَ اللَّهُ وَجِلَتْ قُلُوبُهُمْ ۝ وَالَّذِينَ

يُؤْتُونَ مَا آتَوْا وَقُلُوبُهُمْ وَجَلَةٌ أَنَّهُمْ إِلَىٰ رَبِّهِمْ رَاجِعُونَ ۝

أُولَٰئِكَ يُسِرُّ عَوْنٌ فِي الْحَيَاتِ وَهُمْ لَهَا سَابِقُونَ ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
સય્યિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
મુબશ્શિરિ-લિલ-મુખ્બિતીન-ભિમા-કા-
લલ્લાહુલ-અમીમ : વ-બશ્શિરિલ
મુખ્બિતીનલ્લમીન-ઘઝા-મુકિરલ્લાહુ-વ-
જિલત-ફુલૂબુહુમ-વલ્લમીન-યુઅતૂન-મા-
આતવ્વફુલૂબુહુમ-વ-જિલતુન-અન્નહુમ-
ઘલા-રબ્બિહિમ-રાજિહીન ० ઉલાઘક-
યુસારિહીન-ફિલ-ખેરાતિ-વહુમ-
લહા-સાબિકૂન ०

तर्जमा

“એ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સય્યિદુના મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો આજિઝી કરને વાલોં કો ખુશ ખબરી દેને વાલે હૈં, જૈસા કે અઝમત વાલે અલ્લાહ

पाक का ँरशाद है के ० “और ऐ मडबूअ ! ढुशी सुना दू उन तवाओअ वालों को के जब अल्लाह पाक का ञिक डोता है, उन के दल डरने लगते है” ० “और वोड जो देते हैं, जो कुछ दं और उन के दल डर रहे हैं, यूं के उन को अपने रअ की तरफ डरना है” ० “येड लोग भलाधयों में जल्दी करते हैं और येडी सभ से पहले उन्हें पहुंये ०”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ الْمُبَشِّرِ

لِلصَّابِرِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ: وَبَشِّرِ الصَّابِرِينَ

الَّذِينَ إِذَا أَصَابَتْهُمُ مُصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ

رُجِعُونَ ० أُولَئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِنْ رَبِّهِمْ وَرَحْمَةٌ

وَأُولَئِكَ هُمُ الْمُهْتَدُونَ ० إِنِّي جَزَيْتُهُمُ الْيَوْمَ بِمَا

صَبَرُوا إِنَّهُمْ هُمُ الْفَائِزُونَ ०

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
 સય્યિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
 મુબશ્શિરિ-લિસ્સાબિરીન-બિમા-કા-
 લલ્લાહુલ-અઝીમ : વ-બશ્શિરિસ્સાબિરીન ०
 અલ્લઝીન-ઘઝા-અસાબતહુમ-મુસીબતુન-
 કાલૂ-ઘન્ના-લિલ્લાહિ-વ-ઘન્ના-ઘલયહિ-
 રાજિબીન ० ઉલાઘક-અલયહિમ-
 સલવાતુમ્મિન-રબ્બિહિમ-વ-રહમતુવં-વ
 ઉલાઘક-અલયહિમ સલવાતુમ્મિર્રબ્બિહિમ-વ-
 રહમતુવં-વ-ઉલાઘક-હુમુલ મુહતદૂન ० ઘન્ની
 જઝયતુહુમુલયૌમ-બિમા-સબરૂ-અન્નહુમ-
 હુમુલ-ફાઘૂન ०

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સય્યિદુના મુહમ્મદ ﷺ પર દુરૂદ ભેજ, જો સબ્ર કરને વાલોં કો ખુશ ખબરી દેને વાલે હૈ, જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ० “ઔર ખુશ ખબરી સુના ઉન સબ્ર વાલોં કો, કે જબ ઉન પર કોઈ મુસીબત પળે, તો કહે : હમ અલ્લાહ પાક કે માલ હૈં ઔર હમ કો ઉસી કી તરફ ફિરના. યેહ લોગ હૈ જિન પર ઉન કે રબ કી દુરૂદે હૈં ઔર રહમત ઔર યેહી લોગ રાહ પર હૈ” ० “બેશક ! આજ મૈં ને ઉન કે સબ્ર કા ઉન્હેં યેહ બદલા દિયા કે વોહી કામ્યાબ હૈ ०”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ الْمُبَشِّرِ
 لِلْكَاطِبِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ: الَّذِينَ يُنْفِقُونَ
 وَالْكُظُمِينَ الْغَيْظِ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ وَالْعَافِينَ
 عَنِ النَّاسِ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ ○ فَمَنْ عَفَا وَأَصْلَحَ
 فَأَجْرُهُ عَلَى اللَّهِ إِنَّهُ لَا يُحِبُّ الظَّالِمِينَ ○

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
 સય્યિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
 મુબશ્શિરિ-લિલ-કાતિમીન-બિમા-કા-
 લલ્લાહુલ-અમીમ : અલ્લમીન-યુન્ફિફૂન-
 ફિસ્સર્રાઇ-વદર્રાઇ-વલ-કાતિમીનલ-ગૈમ-વલ-
 આફીન-અનિન્નાસિ-વલ્લાહુ-યુહિબ્બુલ-મુહ-
 સિનીન ○ ફમન-અફા-વ-અસ્લહ-ફ-
 અજરુહુ-અલ્લાહિ-ઇન્નહુ-લા-
 યુહિબ્બુમ્માલિમીન ○

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સય્યિદુના
 મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો ગુસ્સે કો પી જાને

वालों को भुश भबरी देने वाले हैं, जैसा के अजमत वाले अल्लाह पाक का ँरशाद है के ० “वोह जो अल्लाह की राह में भर्य करते हैं, भुशी में और रंज में और गुस्सा पीने वाले और लोगों से दर गुजर करने वाले और नेक लोग अल्लाह के महबूब है” ० “तो जिस ने मुआफ़ किया और काम संवारा उस का अज अल्लाह पाक पर है. बेशक ! वोह दोस्त नहीं रभता जालिभों को ०”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِلْمُحْسِنِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ :

وَأَحْسِنُوا إِنَّ اللَّهَ يُحِبُّ الْمُحْسِنِينَ ० مَنْ

جَاءَ بِالْحَسَنَةِ فَلَهُ عَشْرُ أَمْثَالِهَا وَمَنْ جَاءَ

بِالسَّيِّئَةِ فَلَا يُجْزَى إِلَّا مِثْلَهَا وَهُمْ لَا يُظْلَمُونَ ०

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
 સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
 મુબશ્શિરિ-લિલ-મુહસિનીન-ઊમા-કા-
 લલ્લાહુલ-અઝીમ : વ-અહસિનૂ-
 ઇન્નાલ્લાહ-યુહિબ્બુલ-મુહસિનીન ૦
 મન-જાઅ-ઊલિ-હસનતિ-ફલહુ-અશરુ-
 અમ્સાલિહા-વ-મન-જાઅ-ઊસ્સચ્ચિઅતિ-
 ફલા-યુજાઝા-ઇલ્લા-મિસ્લહા-વ-હુમ-લા-
 યુઝલમૂન ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સચ્ચિદુના મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો ભલાઈ કરને વાલોં કો ખુશ ખબરી દેને વાલે હૈં, જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ૦ “ઔર ભલાઈ વાલે હો જાઓ બેશક ! ભલાઈ વાલે અલ્લાહ કે મહબૂબ હૈ” ૦ “જો એક નેકી લાએ તો ઉસ કે લિયે ઉસ જૈસી દસ હૈ ઔર જો બુરાઈ લાએ તો ઉસે બદલા ન મિલેગા મગર ઉસ કે બરાબર ઔર ઉન પર ઝુલ્મ ન હોગા ૦”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ
 الْمُبَشِّرِ لِلْمُتَصَدِّقِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ:
 وَأَنْ تَصَدَّقُوا خَيْرٌ لَكُمْ ۝ إِنَّ اللَّهَ يُجْزِي
 الْمُتَصَدِّقِينَ ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
 સય્યિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
 મુબશ્શિરિ-લિલ-મુતસદ્દિકીન-બિમા-કા-
 લલ્લાહુલ-અઝીમ : વ-અન-તસદ્દકૂ-
 ખૈરુલ્લકુમ-ઇન-ફુન્તુમ-તઅ-લમૂન ०
 ઇન્નલ્લાહ-યજ-ઝિલ મુતસદ્દિકીન ०

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સય્યિદુના મુહમ્મદ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ પર દુરુદ ભેજ, જો સદકા દેને વાલોં કો ખુશ ખબરી દેને વાલે હૈં જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ० “ઔર યેહ કે સદકા દેના તુમ્હારે લિયે બેહતર હૈ, અગર તુમ જાનો” ० “બેશક ! અલ્લાહ પાક ખૈરાત વાલોં કો સિલા દેતા હૈ ०”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ
 الْمُبَشِّرِ لِلْمُنْفِقِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ:
 وَهَمَّا رَزَقْنَاهُمْ يُنْفِقُونَ ○ وَمَا أَنْفَقْتُمْ مِنْ
 شَيْءٍ فَهُوَ يُخْلِفُهُ ○ وَهُوَ خَيْرُ الرَّازِقِينَ ○

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
 સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
 મુબશ્શિરિ-લિલ-મુન્ફિકીન-બિમા-કા-
 લલ્લાહુલ-અઝીમ : વ-મિમ્મા-રઝકનાહુમ-
 યુન્ફિકૂન-વમા-અન્ફકતુમ્મિન-શયધન-
 ફહુવ-યુખ્લિફુહ ○ વ-હુવ ખેરુરાઝિકીન ○

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સચ્ચિદુના મુહમ્મદ ﷺ પર દુરૂદ ભેજ, જો અલ્લાહ પાક કી રાહ મેં ખર્ચ કરને વાલોં કો ખુશ ખબરી દેને વાલે હૈ જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ○ “ઔર હમારી દી હુઈ રોઝી મેં સે હમારી રાહ મેં ખર્ચ કરતે હૈ” ○ “ઔર જો યીઝ તુમ અલ્લાહ કી રાહ મેં ખર્ચ કરો વોહ ઉસ કે બદલે ઔર દેગા ઔર વોહ સબ સે બહેતર રિઝ્ક દેને વાલા હૈ ○”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْبَشِيرِ لِلشَّاكِرِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ : وَاشْكُرُوا

نِعْمَتَ اللَّهِ إِنْ كُنْتُمْ آيَاةً تَعْبُدُونَ لَئِنْ شَكَرْتُمْ

لَأَزِيدَنَّكُمْ وَلَئِنْ كَفَرْتُمْ إِنَّ عَذَابِي لَشَدِيدٌ ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-મુબશ્શિરિ-
લિશ્શાકિરીન-બિમા-કા-લલ્લાહુલ-અઝીમ :
વશકુરૂ-નિઅમતલ્લાહિ-ઇન-કુન્તુમ-ઇચ્ચાહુ-
તઅબુદૂન ૦ લઇન-શકરતુમ-લ-અઝીદન્નકુમ-
વ-લઇન-કફરતુમ-ઇન્ન-અઝાબી-લશદીદ ૦

﴿ تَرْجُمَا ﴾

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સચ્ચિદુના મુહમ્મદ ﷺ પર દુરૂદ ભેજ, જો શુક કરને વાલોં કો ખુશ ખબરી દેને વાલે હૈ જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ૦ “ઐર અલ્લાહ કી ને’મત કા શુક કરો અગર તુમ ઉસ કી ઈબાદત કરતે હો” ૦ “અગર શુક કરોગે તો મૈં તુમ્હેં ઐર દુંગા ઐર અગર ના શુકી કરોગે તો મેરા અઝાબ સખ્ત હૈ ૦”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ
 الْمُبَشِّرِ لِلْسَّائِلِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ :
 فَإِنِّي قَرِيبٌ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ ○
 وَقَالَ رَبُّكُمْ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ ○

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
 સય્યિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
 મુબશ્શિરિ-લિસ્સાઘલીન-બિમા-કા-
 લલ્લાહુલ-અઝીમ : ફ-ઇન્ની-કરીબુન-
 ઉજુબુ-ઇઅવતદાઇ-ઇન્ના-ઇઆન ○ વ-કાલ
 રબુકુમુદઇની-અસ્તજિબ-લકુમ ○

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સય્યિદુના
 મુહમ્મદ ﷺ પર દુરૂદ ભેજ, જો અલ્લાહ પાક સે
 માંગને વાલોં કો ખુશ ખબરી દેને વાલે હૈં જૈસા કે અઝમત વાલે
 અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ○ “તો મૈં નઝદીક હૂં, દુઆ
 કબૂલ કરતા હૂં પુકારને વાલે કી, જબ મુઝે પુકારે” ○ “ઔર
 તુમ્હારે રબ ને ફરમાયા : મુઝ સે દુઆ કરો, મૈં કબૂલ કરૂંગા ○”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْبَشِيرِ لِلصَّالِحِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ: إِنَّ الْأَرْضَ

يَرِثُهَا عِبَادِيَ الصَّالِحُونَ ○ أَوْلَيْكَ هُمُ الْوَرِثُونَ

الَّذِينَ يَرِثُونَ الْفِرْدَوْسَ هُمْ فِيهَا خَالِدُونَ ○

अल्लाहुम्म-सल्लि-व-सल्लिम-अला-
सय्यिदिना-मुहम्मदिनिल-अशीरिल-
मुअशिशिरि-लिरसालिहीन-अिमा-कालल्लाहुव-
अमीम : अन्नल-अर्द-यरिसुहा
धभादियरसालिहून-उलाधक-हुमुल-
वारिसून ○ अल्लागीन-यरिसूनल-फिरदौस-
हुम-झीहा-आलिहून ○

तर्जमा

“अै अल्लाह पाक ! हमारे सरदार हजरते सय्यिदुना मुहम्मद صَلَّ اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ पर दुइद त्मेज, जो नेक लोगों को भुश भबरी देने वाले हैं जैसा के अजमत वाले अल्लाह पाक का एरशाद है के ○ “बेशक ! इस जमीन के वारिस मेरे नेक बन्दे होंगे” ○ “येही लोग वारिस है फिरदौस की मीरास पाअेंगे वोह उस में हमेशा रहेंगे ○”

اَللّٰهُمَّ صَلِّ وَسَلِّمْ عَلٰى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيْرِ

اَلْبَشِيْرِ لِلْمُصَلِّيْنَ بِمَا قَالَ اللهُ الْعَظِيْمُ : اِنَّ الله

وَمَلٰئِكَتُهٗ يُصَلُّوْنَ عَلٰى النَّبِيِّ يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا

صَلُّوْا عَلَيْهِ وَسَلِّمُوْا تَسْلِيْمًا ۝ يُّوْتِكُمْ كِفٰلَيْنِ

مِّنْ رَّحْمَتِهٖ وَيَجْعَلْ لَّكُمْ نُوْرًا تَمْشُوْنَ بِهٖ وَيَغْفِرْ

لَكُمْ وَاللهُ غَفُوْرٌ رَّحِيْمٌ ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
મુબશ્શિરિ-લિલ-મુહસિનીન-બિમા-કા-
લલ્લાહુલ-અમીમ : ઇન્નલ્લાહ વ-
મલાઇકતહુ-યુસલ્લૂન-અલન્નબિચ્ચિ-યા-
અચ્ચુહલ્લામીન-આમનૂ-સલ્લૂ-અલયહિ-વ-
સલ્લિમૂ-તસ્લીમા ० યૂઅતિકુમ-કિફલેનિ-
મિર્હમતિહી-વ-યજઅલ-લકુમ-નૂરન-
તમ્શૂન-બિહી-વ-યગ્ફિર-લકુમ-
વલ્લાહુ-ગફુરુર્હીમ

तर्जमा

“अै अल्लाह पाक ! हमारै सरदार हजरते सय्यिदुना मुहम्मद ﷺ पर दुरुद भेज, जो नेकी करने वालों को भुश भबरी देने वाले हैं जैसा के अजमत वाले अल्लाह पाक का धरशाद है के ० “बेशक ! अल्लाह पाक और उस के फिरिश्ते दुरुद भेजते हैं उस गैब भताने वाले (नबी) पर अै धमान वालो ! उन पर दुरुद और भूब सलाम भेजो” ० “वोह अपनी रहमत के दो हिससे तुम्हें अता इरमाअेगा और तुम्हारे लिये नूर कर देगा, जिस में यलो और तुम्हें भप्श देगा और अल्लाह भप्शने वाला महेरभान है ०”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْبَشِيرِ لِلْبَشَرِ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ: ۞ وَبَشِّرِ

الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ۞ لَهُمُ الْبُشْرَى

فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ لَا تَبْدِيلَ لِكَلِمَاتِ اللَّهِ

ذَلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ ۞

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
મુબશ્શિરિ-લિલ-મુબશ્શિરીન-બિમા-કા-
લલ્લાહુલ-અમીમ : વ-બશ્શિરિલલ્લમીન-
આમનૂ-વ-અમિલુસ્સાલિહાત ૦ લહુમુલ-
બુશરા-ફિલ-હયાતિદુન્યા-વ-ફિલ-
આખિરતિ-લા-તબ્દીલ-લિકલિમાતિલ્લાહિ-
માલિક-હુવલ-ફવમુલ-અમીમ ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સચ્ચિદુના મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો ખુશ ખબર દેને વાલોં કો ખુશ ખબરી દેને વાલે હેં જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ૦ “ઔર ખુશ ખબરી દે ઉન્હેં જો ઈમાન લાએ ઔર અચ્છે કામ કિયે” ૦ “ઉન્હેં ખુશ ખબરી હૈ દુન્યા કી ઝિન્દગી મેં ઔર આખિરત મેં અલ્લાહ કી બાર્તે બદલ નહીં સકતી, યેહી બળી કામ્યાબી હૈ ૦”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِلْفَائِزِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ :

وَمَنْ يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
સય્યિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
મુબશ્શિરિ-લિલફાઘમીન-બિમા-કા-
લલ્લાહુલ-અમીમ : વમન-ચુતિઘલ્લાહ-વ-
રસૂલહુ-ફકદ-ફાઝ-ફવઝન-અમીમા ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સય્યિદુના મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો મુરાદ પાને વાલોં કો ખુશ ખબરી દેને વાલે હેં, જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ૦ “ઔર જો અલ્લાહ પર ઔર ઉસ કે રસૂલ કી ફરમાં બરદારી કરે, ઉસ ને બળી કામ્યાબી પાઈ.”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِلزَّاهِدِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ :

الْبَالُ وَالْبُنُونَ زِينَةُ الْحَيَاةِ الدُّنْيَا وَالْبَقِيَّةُ

الصُّلْحُ خَيْرٌ عِنْدَ رَبِّكَ تَوَّابًا وَخَيْرٌ أَمَلًا ٥

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
સય્યિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
મુબશ્શિરિ-લિમ્મ્માહિદીન-બિમા-કા-
લલ્લાહુલ-અમ્મીમ : અલમાલુ-વલ-બનૂન-
મીનતુલ-હયાતિદુન્યા-વલ-
બાકિયાતુસ્સાલિહાતુ-ખૈરુન-ઇન્દ-રબ્બિક-
સવાબંવ-વ-ખૈરુન-અમલા ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સય્યિદુના મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો પરહેઝગારોં કો ખુશ ખબરી દેને વાલે હૈં જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈં કે ૦ “માલ ઓર બેટે યેહી જીતી (ઝિન્દા) દુન્યા કા સિંગાર હૈં ઓર બાકી રહને વાલી અચ્છી બાતેં, ઉન કા સવાબ તુમ્હારે રબ કે યહાં બેહતર ઓર વોહ ઉમ્મીદ મેં સબ સે ભલી ૦”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِلْأُمِّيِّينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ :

كُنْتُمْ خَيْرَ أُمَّةٍ أُخْرِجَتْ لِلنَّاسِ

تَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَتَنْهَوْنَ عَنِ الْمُنْكَرِ ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
સય્યિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
મુબશ્શિરિ-લિલ-ઉમ્મિયીન-બિમા-કા-
લલ્લાહુલ-અઝીમ : કુન્તુમ-ખેર-ઉમ્મતિન-
ઉખ-રિજત-લિન્નાસિ-તઅમુર્રન-બિલ-
મઅર્રફિ-વ-તન્હવન-અનિલ-મુન્કર ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સય્યિદુના મુહમ્મદ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ પર દુરૂદ ભેજ, જો બે પદે લિખે લોગોં કો ખુશ ખબરી દેને વાલે હૈં જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ૦ “તુમ બેહતર હો ઉન સબ ઉમ્મતોં મેં જો લોગોં મેં ઝાહિર હુઈ, ભલાઈ કા હુકમ દેતે હો ઓર બુરાઈ સે મન્અ કરતે હો ૦”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِلْمُصْطَفَيْنِ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ :

ثُمَّ أَوْرَثْنَا الْكِتَابَ الَّذِينَ اصْطَفَيْنَا مِنْ عِبَادِنَا

فَمِنْهُمْ ظَالِمٌ لِنَفْسِهِ وَمِنْهُمْ مُقْتَصِدٌ وَمِنْهُمْ

سَابِقٌ بِالْخَيْرَاتِ يُأْتِنُ اللَّهُ ذَلِكَ هُوَ الْفَضْلُ الْكَبِيرُ ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
 સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
 મુબશ્શિરિ-લિલ-મુસ્તફીન-બિમા-કા-
 લલ્લાહુલ-અઝીમ : સુમ્મ-અવ-રસનલ-
 કિતાબલ્લઝીનસ્તફૈના-મિન-ઘબાદિના-
 ફમિન્હુમ-ઝાલિમુલ્લિનફિસહિ-વ-મિન્હુમ-
 મુક્તસિદુન-વ-મિનહુમ-સાબિકુમ-બિલ-
 ખેરાતિ-બિઘઝિનલ્લાહિ-ઝાલિક-હુવલ-
 ફઝલુલ-કબીર ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સચ્ચિદુના મુહમ્મદ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ પર દુરુદ ભેજ, જો બરગુઝીદા લોગોં કો ખુશ ખબરી દેને વાલે હૈં જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ૦ “ફિર હમ ને કિતાબ કા વારિસ ક્રિયા, અપને યુને હુએ (Selected) બન્દોં કો, તો ઉન મેં કોઈ અપની જાન પર ઝુલ્મ કરતા હૈં ઓર ઉન મેં કોઈ મિયાના ચાલ (દરમિયાની ચાલ) પર હૈં ઓર ઉન મેં કોઈ વોહ હૈં જો અલ્લાહ કે હુકમ સે ભલાઈયોં મેં સબકત લે ગયા, યેહી બળા ફઝલ હૈ ૦”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِلْمُذْنِبِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ: قُلْ يُعْبَادِي

الَّذِينَ اسْرَفُوا عَلَىٰ أَنفُسِهِمْ لَا تَقْنَطُوا مِن رَّحْمَةِ اللَّهِ

إِنَّ اللَّهَ يَغْفِرُ الذُّنُوبَ جَمِيعًا إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ ○

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-મુબશ્શિરિ-
લિલ-મુઝ્નિબીન-બિમા-કા-લલ્લાહુલ-અઝીમ :
કુલ-યા-ઇબાદિયલ્લાઝીન-અસ-રફૂ-અલા-
અન્કુસિહિમ-લા-તકનતૂ-મિર્હમતિલ્લાહિ-
ઇન્નલ્લાહ-યગફિરુઝ્ઝુનૂબ-જમીઅન-ઇન્નહુ-
હુવલ-ગફૂરર્હીમ ○

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સચ્ચિદુના મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો ગુનાહગારોં કો ખુશ ખબરી દેને વાલે હૈં જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઇરશાદ હૈ કે ○ “તુમ ફરમાઓ ઐ મેરે વોહ બન્દો ! જિન્હોં ને અપની જાનોં પર ઝિયાદતી કી, અલ્લાહ કી રહમત સે ના ઉમ્મીદ ન હો, બેશક ! અલ્લાહ સબ ગુનાહ બખ્શ દેતા હૈ, બેશક ! વોહી બખ્શને વાલા મહેરબાન હૈ ○”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِلْمُسْتَغْفِرِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ:

وَمَنْ يَعْمَلْ سُوءًا أَوْ يَظْلِمْ نَفْسَهُ ثُمَّ

يَسْتَغْفِرِ اللَّهَ يَجِدِ اللَّهَ غَفُورًا رَحِيمًا ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા
સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ
મુબશ્શિરિ-લિલ-મુસ્તગફિરીન-બિમા-કા
લલ્લાહુલ-અઝીમ : વ-મંચ્યઅમલ-સૂઅન
અવ-ચઝલિમ-નફ્સહુ-સુમ્મ-ચસ્તગ-
ફિરિલ્લાહ-ચજિદિલ્લાહ-ગફૂર્રહીમા ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સચ્ચિદુના મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો બખ્શિશ માંગને વાલોં (ઇસ્તિગ્ફાર કરને વાલોં) કો ખુશ ખબરી દેને વાલે હૈં જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈં કે ૦ “ઐર જો કોઈ ખુરાઈ કરે યા અપની જાન પર ઝુલ્મ કરે, ફિર અલ્લાહ સે બખ્શિશ યાહે તો ઝરૂર અલ્લાહ કો બખ્શને વાલા મહેરબાન પાએગા ૦”

اَللّٰهُمَّ صَلِّ وَسَلِّمْ عَلٰى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيْرِ

الْمُبَشِّرِ لِلْمُقَرَّبِيْنَ بِمَا قَالَ اللهُ الْعَظِيْمُ : اِنَّ الَّذِيْنَ

سَبَقَتْ لَهُمْ مِّنَّا الْحُسْبٰى اُولٰٓئِكَ عَنْهَا مُبْعَدُوْنَ

لَا يَسْمَعُوْنَ حَسِيْسَهَا وَهُمْ فِيْ مَا اشْتَهَتْ اَنْفُسُهُمْ

خٰلِدُوْنَ ۝ لَا يَخْزُنُهُمُ الْفَزَعُ الْاَكْبَرُ وَتَتَلَقَّهُمْ

الْبَلٰٓئِكَةُ هٰذَا يَوْمُكُمْ الَّذِيْ كُنْتُمْ تُوعَدُوْنَ ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
મુબશ્શિરિ-લિલ-મુકર્રબીન-બિમા-કા-
લલ્લાહુલ-અઝીમ : ઇન્નલ્લઝીન-સબકત-
લહુમ્મિન્નલ-હુસ્ના-ઉલાઘક-અન્હા-
મુબઅદૂન ० લા-યસ્મઉન-હસીસહા-વ-
હુમ-ફી-મશતહત-અન્કુસુહુમ-ખાલિદૂન ०
લા- યહજુનુહુમુલફઝઅલ-અકબરુ-વ-
તતલક્કાહુમુલ-મલાઘકતુ ० હાઝા-
ચૌમુકુમુલ્લઝી-કુન્તુમ-તૂઅદૂન ०

तर्जमा

“अै अल्लाह पाक ! हमारे सरदार हजरते सय्यिदुना मुहम्मद ﷺ पर दुरुद भेज, जो अल्लाह का कुर्ब हासिल करने वालों को भुश भबरी देने वाले हैं जैसा के अजमत वाले अल्लाह पाक का ँरशाद है के ० “बेशक ! वोह जिन के लिये हमारा वा’दा भलाई का हो युका वोह अपनी मन मानती ज्वाहिशों में हमेशा रहेंगे” ० “उन्हें गम में न डालेगी वोह सब से भणी गभराहट और झिरिश्ते उन की पेशवाई को आअेंगे के येह हैं तुम्हारा वोह दिन जिस का तुम से वा’दा था ०”

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ الْبَشِيرِ

الْمُبَشِّرِ لِلْمُسْلِمِينَ بِمَا قَالَ اللَّهُ الْعَظِيمُ :

إِنَّ الْمُسْلِمِينَ وَالْمُسْلِمَاتِ وَالْمُؤْمِنِينَ

وَالْمُؤْمِنَاتِ وَالْقَنَاتِ وَالْقَنَاتِ

وَالصَّادِقِينَ وَالصَّادِقَاتِ وَالصَّابِرِينَ

وَالصَّبْرِ وَالْحُشْعِينَ وَالْحُشْعَتِ

وَالْمُتَصَدِّقِينَ وَالْمُتَصَدِّقَاتِ وَالصَّامِّينَ

وَالصَّيِّمَاتِ وَالْحَفِظِينَ فُرُوجَهُمْ وَالْحَفِظَاتِ

وَالذَّاكِرِينَ اللَّهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ أَعَدَّ اللَّهُ لَهُمْ ۝

مَغْفِرَةً وَأَجْرًا عَظِيمًا ۝ وَأَنْ لَيْسَ لِلْإِنْسَانِ

إِلَّا مَا سَعَى ۝ وَأَنَّ سَعْيَهُ سَوْفَ يُرَى ۝ ثُمَّ

يُجْزَأُ الْجَزَاءَ الْأَوْفَى ۝ وَأَنَّ إِلَىٰ رَبِّكَ الْمُنْتَهَى ۝

અલ્લાહુમ્મ-સલ્લિ-વ-સલ્લિમ-અલા-
 સચ્ચિદિના-મુહમ્મદિનિલ-બશીરિલ-
 મુબશ્શિરિ-લિલ-મુઅમિનીન-બિમા-કા-
 લલ્લાહુલ-અઝીમ : ઇન્નલ-મુસ્લિમીન-વલ-
 મુસ્લિમાતિ-વલ-મુઅમિનીન-વલ-
 મુઅમિનાતિ-વલ-કાનિતીન-વલ-કાનિતાતિ-
 વસ્સાદિકીન-વસ્સાદિકાતિ-વસ્સાબિરીન-
 વસ્સાબિરાતિ-વલ-ખાશિઈન-વલ-
 ખાશિઆતિ-વલ-મુતસદ્દિકીન-વલ-
 મુતસદ્દિકાતિ-વસ્સાઈમીન-વસ્સાઈમાતિ-
 વલ-હાફિઝીન-ફુરુજહુમ-વલ-હાફિઝાતિ-
 વઝ્ઝાકિરીનલ્લાહ-કસીરન-વઝ્ઝાકિરાતિ-
 અઅદલ્લાહુ-લહુમ-મઝ્ઝિરતન-વ-અજરન-
 અઝીમા ૦ વ-અલ્લયસ-લિલ-ઇન્સાનિ-
 ઇલ્લા-મા-સઆ ૦ વ-અન્ન-સઅયહુ-સૌફ-
 યુરા ૦ સુમ્મ-યુજ્ઝાહુલ-જઝાઅલ-ઓફા ૦
 વ-અન્ન-ઇલા-રબ્બિલ્કલ-મુન્તાહા ૦

તર્જમા

“ઐ અલ્લાહ પાક ! હમારે સરદાર હઝરતે સચ્ચિદુના મુહમ્મદ ﷺ પર દુરુદ ભેજ, જો મોઅમિનોં કો ખુશ ખબરી દેને વાલે હૈં જૈસા કે અઝમત વાલે અલ્લાહ પાક કા ઈરશાદ હૈ કે ૦ “બેશક ! મુસલમાન મર્દ ઔર મુસલમાન ઔરતેં ઔર ઈમાન વાલે ઔર ઈમાન વાલિયાં ઔર ફરમાં બરદાર ઔર ફરમાં બરદારીં ઔર સચ્ચે ઔર સચ્ચિયાં ઔર સબ્ર વાલે ઔર સબ્ર વાલિયાં ઔર આજિઝી કરને વાલે ઔર આજિઝી કરને વાલિયાં ઔર ખૈરાત કરને વાલે ઔર ખૈરાત કરને વાલિયાં ઔર રોઝે વાલે ઔર રોઝે વાલિયાં ઔર અપની પારસાઈ (શર્મગાહ) કી હિફાઝત કરને વાલે ઔર હિફાઝત કરને વાલિયાં ઔર અલ્લાહ કો બહુત યાદ કરને વાલે ઔર યાદ કરને વાલિયાં, ઉન સબ કે લિયે અલ્લાહ ને બખ્શિશ ઔર બળા સવાબ તય્યાર રખા હૈ” ૦ “ઔર યેહ કે આદમી ન પાએગા, મગર અપની કોશિશ ઔર યેહ કે ઉસ કી કોશિશ અન્કરીબ દેખી જાએગી, ફિર ઉસ કા ભરપૂર બદલા દિયા જાએગા ઔર યેહ કે બેશક ! તુમ્હારે રબ હી કી તરફ ઈન્તિહા હૈ ૦”

اللَّهُمَّ صَلِّ عَلَيْهِ صَلَاةً تُشْرِحُ بِهَا الصُّدُورُ

وَتَهْوِنُ بِهَا الْأُمُورُ وَتَنْكَشِفُ بِهَا السُّتُورُ

وَسَلِّمْ تَسْلِيمًا كَثِيرًا آدَاءِمًا

إلى يوم الدين 0 دَعُوهُمْ فِيهَا سُبْحَانَكَ

اللَّهُمَّ وَتَحِيَّتُهُمْ فِيهَا سَلَامٌ وَآخِرُ

دَعُوهُمْ أَنْ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ 0

અલ્લાહુમ્મ-સલ્લિ-અલયહિ-સલાતન-
તુશ-રિહુ-બિહસ્સુદૂરુ-વ-તહુનુ-બિહલ-ઉમૂરુ-
વ-તન્કશિકુ-બિહસ્સુતૂરુ-વ-સલ્લિમ-તસ્લીમન-
કસીરન-દાઇમન-ઇલા-યોમિદીન ૦ દઅવાહુમ-
ફીહા-સુહાનકલ્લાહુમ્મ-વ-તહિય્યતુહુમ-ફીહા-
સલામુન-વ-આખિરુ-દઅવાહુમ-અનિલ-હમ્દુ-
લિલ્લાહિ-રબ્બિલ-આલમીન ૦

તર્જમા

“એ અલ્લાહ પાક ! તેરે મહબૂબ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ પર
એસા દુરૂદ ભેજ જિસ સે હમારે સીને કુશાદા હો જાએ ઓર
જિસ સે સારે કામ આસાન હો જાએ ઓર જિસ સે પોશીદા બાતેં
ખુલ જાએ ઓર કિયામત તક હમેશા કસરત સે ખૂબ સલામ
ભેજ ૦ “ઉન કી દુઆ ઉસ મેં યેહ હોગી કે એ અલ્લાહ ! તુએ
પાકી હૈ ઓર ઉન કે મિલતે વક્ત ખુશી કા પહલા બોલ સલામ
હૈ ઓર ઉન કી દુઆ કા ખાતિમા યેહ હૈ કે સબ ખૂબિયાં
અલ્લાહ પાક કે લિયે હૈ જો રબ હૈ સારે જહાન કા ૦”

دُرُودٌ تُنَجِّينَا

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

اللَّهُمَّ صَلِّ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ صَلَاةً
 تُنَجِّينَا بِهَا مِنْ جَمِيعِ الْأَهْوَالِ وَالْآفَاتِ *
 وَتَقْضِي لَنَا بِهَا جَمِيعَ الْحَاجَاتِ * وَتُطَهِّرُنَا
 بِهَا مِنْ جَمِيعِ السَّيِّئَاتِ * وَتَرْفَعُنَا بِهَا
 عِنْدَكَ أَعْلَى الدَّرَجَاتِ * وَتُبَلِّغُنَا بِهَا أَقْصَى
 الْغَايَاتِ * مِنْ جَمِيعِ الْخَيْرَاتِ * فِي
 الْحَيَاةِ وَبَعْدَ الْمَمَاتِ إِنَّكَ مُجِيبُ الدَّعَوَاتِ وَ
 رَافِعُ الدَّرَجَاتِ وَيَا قَاضِيَ الْحَاجَاتِ وَيَا كَافِيَ
 الْمُهْمَاتِ وَيَا دَافِعَ الْبَلِيَّاتِ وَيَا حَلَّ
 الْمَشْكَاتِ اغْنِنِي اغْنِنِي يَا إِلَهِي إِنَّكَ
 عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ *

દુરૂં વુનજજુના

અલ્લાહુમ્મ-સલ્લિ-અલા-સય્યિદિના-
મુહમ્મદિંવ-વ-અલા-આલિહી-સલાતન-
વુનજજુના-બિહા-મિન-જમીઘલ-અહવાલિ-
વલ-આફાતિ-વ-તકદી-લના-બિહા-
જમીઘલ-હાજતિ-વ-તુતહિહરુના-બિહા-
મિન-જમીઘસ્સય્યિઆતિ-વ-તર-ફુના-
બિહા-ઘન્ક-અલદરજતિ-વ-
તુબલ્લિગુના-બિહા-અકસલ-ગાયાતિ-
મિન-જમીઘલ-ખૈરાતિ-ફિલ-હયાતિ-વ-
બઅદલ-મમાતિ ૦ ઘન્ક-
મુજુબુદઅવાતિ-વ-રાફિઉદરજતિ-વ-યા-
કાદિયલ-હાજતિ-વ-યા-કાફિયલ-
મુહિમ્માતિ-વ-યા-દાફિઅલ-બલિય્યાતિ-વ-
યા-હલ્લલમુશિક્લાતિ-અગિરની-
અગિરની-અગિરની-યા-ઘલાહી-ઘન્ક-
અલા-ફુલ્લિ-શૈઘન-કદીર ૦

तर्जमा

“अै अल्लाह पाक ! हमारै सरदार हजरते सय्यिदुना मुहम्मद صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ और उन की आल पर दुरद भेज अैसा दुरद के उस के वसीले से हमें तमाम डर, भौंफ और आइतों से नजत मिल जाअे और जिस की बरकत से हमारी तमाम हाजतें पूरी हो जाअें और जिस के तुईल हम तमाम गुनाहों से पाको साइ हो जाअे और जिस के वसीले से हम तेरी बारगाह में उंये दरजों पर मुतमकिकन हों और जिस के जरीअे हम जिन्दगी की तमाम नेकियों और मरने के बा'द की तमाम अख्ठाईयों से पूरा इाईदा हासिल कर सकें. अै हमारे रब ! तू ही हमारे दरजत को बुलन्द करने वाला, हमारी हाजतों को पूरा करने वाला, सप्त मुसीबतों में पूरी मदद करने वाला और बलाओं को दइअ (भत्म) करने वाला है ० अै मुश्किलो को हल करने वाले पाक परवर दिगार ! हमारी इरियाद को पहुंय, हमारी पुकार सुन, हमारी अर्ज को कबूल इरमा ० अै हमारे मा'बूद ! बेशक ! तू ही हर चीज पर कादिर है ०”

دُرُودِ تَاجُ

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

اللَّهُمَّ صَلِّ عَلَى سَيِّدِنَا وَمَوْلَانَا مُحَمَّدٍ *
 صَاحِبِ التَّاجِ وَالْبِعْرَاجِ وَالْبُرَاقِ وَالْعَلَمِ * دَافِعِ
 الْبَلَاءِ وَالْوَبَاءِ وَالْقَحْطِ وَالْمَرَضِ وَالْأَلَمِ * إِسْمُهُ
 مَكْتُوبٌ مَرْفُوعٌ مَشْفُوعٌ مَّنْقُوشٌ فِي اللُّوحِ وَالْقَلَمِ
 * سَيِّدِ الْعَرَبِ وَالْعَجَمِ * جِسْمُهُ مُقَدَّسٌ
 مُعَطَّرٌ مُطَهَّرٌ مُنَوَّرٌ فِي الْبَيْتِ وَالْحَرَمِ * شَمْسِ
 الضُّحَى * بَدْرِ الدُّجَى * صَدْرِ الْعُلَى * نُورِ
 الْهُدَى * كَهْفِ الْوَرَى * مِصْبَاحِ الظُّلَمِ *
 جَبِيلِ الشِّيمِ * شَفِيعِ الْأُمَمِ * صَاحِبِ الْجُودِ
 وَالْكَرَمِ * وَاللَّهِ عَاصِيَهُ * وَجَبْرِيلُ خَادِمُهُ *
 وَالْبُرَاقُ مَرْكَبُهُ * وَالْبِعْرَاجُ سَفْرُهُ *

وَسِدْرَتُ الْمُنْتَهَى مَقَامُهُ * وَقَابِ قَوْسَيْنِ
 مَطْلُوبُهُ * وَالْمَطْلُوبُ مَقْصُودُهُ * وَالْمَقْصُودُ
 مَوْجُودُهُ * سَيِّدِ الْمُرْسَلِينَ * خَاتِمِ النَّبِيِّينَ *
 شَفِيعِ الْمُذْنِبِينَ * أَنَيْسِ الْغَرِيبِينَ * رَحْمَةِ
 لِلْعَالَمِينَ * رَاحَةِ الْعَاشِقِينَ * مُرَادِ الْمُشْتَاقِينَ
 * شَمْسِ الْعَارِفِينَ * سِرَاجِ السَّالِكِينَ *
 مِصْبَاحِ الْمُقَرَّبِينَ * مُحِبِّ الْفُقَرَاءِ وَالْغُرَبَاءِ
 وَالْمَسَاكِينِ * سَيِّدِ الثَّقَلَيْنِ * نَبِيِّ الْحَرَمَيْنِ *
 إِمَامِ الْقِبْلَتَيْنِ * وَسَيِّدِنَا فِي الدَّارَيْنِ * صَاحِبِ
 قَابِ قَوْسَيْنِ * مَحْبُوبِ رَبِّ الْمَشْرِقَيْنِ وَالْمَغْرِبَيْنِ
 * جَدِّ الْحَسَنِ وَالْحُسَيْنِ * مَوْلَانَا وَمَوْلَى الثَّقَلَيْنِ
 * أَبِي الْقَاسِمِ مُحَمَّدِ بْنِ عَبْدِ اللَّهِ * نُورٍ مِّنْ نُورِ
 اللَّهِ * يَا أَيُّهَا الْمُشْتَاقُونَ بِنُورِ جَمَالِهِ * صَلُّوا عَلَيْهِ
 وَآلِهِ وَأَصْحَابِهِ وَسَلِّمُوا تَسْلِيمًا *

દુરૂદે તાજ

અલ્લાહુમ્મ-સલ્લિ-અલા-સચ્ચિદના-
 વ-મોલાના-મુહમ્મદીન સાહિબિતાજિ-વલ-
 મેઅરાજિ-વલ-બુરાકિ-વલ-અલમિ ०
 દાફિઈલ-બલાઈ-વલ-વબાઈ-વલ-કહતિ-
 વલ-મરદિ-વલ-અલમિ ० ઘસ્મુહ્-
 મક્તુબુમ- મરફૂમ-મશ્ફૂમ-મનફૂશુન-
 ફિલ્લૌહિ-વલ-કલમ ० સચ્ચિદિલ-અરબિ-
 વલ-અજમ જિસ્મુહ્-મુકદ્સૂમ્મુઅતરુમ-
 મુતહ્હરુમ-મુનવ્વરુન-ફિલ-બયતિ-વલ-
 હરમ ० શમ્સિદ-દુહા-બદરિદ-દુજા-
 સદરિલ-ઉલા-નૂરિલ-હુદા-કહફિલ-વરા
 મિસ્બાહિમ્-ઝુલમ-જમીલિશિયમ-
 શફીઈલ-ઉમમ ० સાહિબિલજુદિ-વલ-કરમ
 ० વલ્લાહુ-આસિમુહ્ ० વ-જિબ્રીલુ-
 ખાદિમુહ્ વલ-બુરાકુ-મરકબુહ્ ० વલ-
 મેઅરાજુ-સફરુહ્ ० વ-સિદરતુલ-મુન્તાહા-
 મકામુહ્ ० વ-કાબ-કૌસયનિ-મતલૂબુહ્ ०
 વલ-મતલુબુ-મક્સુદુહ્ ० વલ-મક્સુદુ-

મોજુદુહ્, સચ્ચિદિલ-મુરસલીન ૦
 ખાતિમિન્નબિચ્ચીન ૦ શફીઘલ-
 મુઝનિબીન અનીસિલ-ગરીબીન ૦
 રહમતલ્લિલ-આલમીન ૦ રાહતિલ-
 આશિકીન મુરાદિલ-મુશ્તાકીન ૦
 શમ્સિલ-આરિફીન ૦ સિરાજિસ્સાલિકીન
 ૦ મિસ્બાહિલ-મુકર્રબીન ૦ મુહિબ્બિલ-
 ફુક્રાઈ-વલ-ગુરબાઈ-વલ-મસાકીન ૦
 સચ્ચિદિસ્સકલેન ૦ નબિચ્ચિલ-હરમૈન ૦
 ઘમામિલ-કિબ્લતૈન ૦ વસીલતિના-
 ફિદારૈન ૦ સાહિબિ-કાબ-કૌસૈન ૦
 મહબૂબે-રબ્બિલ મશરિકૈનિ-વલ-
 મગરિબૈનિ-જદિલ-હસનિ-વલ-હુસૈનિ-
 મૌલાના-વ- મૌલસ્સકલેનિ-અબિલ-
 કાસિમિ-મુહમ્મદિબ્નિ-અબ્દિલ્લાહિ-નૂરિમ-
 મિન નૂરિલ્લાહિ ૦ યા-અચ્ચુહલ-
 મુશ્તાફૂનબિનૂરિ-જમાલિહી-સલ્લુ-અલૈહિ-
 વ આલિહી-વ-અસ્હાબિહી-વ-સલ્લિમૂ-
 તસ્લીમા ૦

तर्जमा

“अै अल्लाह पाक ! हमारै आका व मौला हजरते मुहम्मद ﷺ पर दुरुद भेज, जे ताज वाले, मे'राज वाले, भुराक वाले और अलम वाले हैं ० जे बला, वभा, कहत, बीमारी और रंजो गम को दूर करने वाले हैं ० जिन का मुबारक नाम लौडे मडकूज और कलम में लिखा हुवा, बुलन्द किया हुवा जणा हुवा और नकश किया हुवा है ० जे अरब और अजम के सरदार हैं ० जिन का जिस्मे पाक का'बा शरीफ और हरम शरीफ में पाक, पुशबूदार, पाक करने वाला और रौशन है ० जे याशत (सुब्हा) के आइताब, यौदहवीं रात के यमकते यांद हैं ० जे बुलन्दी के सदर, छिदायत के नूर, मख्लूक को पनाह देने वाले, अन्धेरो के यराग, अख्शी आदत वाले, तमाम उम्मतों की शफाअत करने वाले और नवाजिशो करम वाले हैं ० और अल्लाह तआला उन की छिफाजत इरमाने वाला है और जिब्रईल عليه السلام उन के जादिम हैं और भुराक उन की सुवारी है ० और मे'राज उन का सकर है और सिदरतुल मुन्तहा उन का मकाम है ० और का'बा कौसैन (कुर्बे ईलाही) उन का मत्वूब है और मत्वूब उन का मकसूद है और मकसूद उन का मौजूद है ० जे तमाम रसूलों के रसूल और तमाम नबियों के जातिम (आबिरी) हैं ० जे गुनहगारों की

શફાઅત કરને વાલે, ગરીબોં કે મદદગાર ઓર તમામ જહાંનોં કે લિયે રહમત હૈં ० જો આશિકોં કી રાહત, મુશ્તાકોં કી મુરાદ, આરિફોં કે લિયે આફતાબ, અલ્લાહ કી રાહ મેં ચલને વાલોં કે લિયે ચિરાગ ઓર મુકર્રબીન કે લિયે રૌશન શમ્અ હૈ ० જો ફકીરોં, ગરીબોં, મિસ્કીનોં સે મહબ્બત કરને વાલે હૈં ० જો દોનોં જહાં કે સરદાર જો દોનોં કિબ્લોં કે ઈમામ હૈં ० જો દુન્યા ઓર ઉકબા (આખિરત) મેં હમારા વસીલા હૈં ० જો કા'બા કૌસૈન કી શાને આલી વાલે ઓર દોનોં મશરિકોં ઓર મઘરિબોં કે રબ કે મહબૂબ હૈ ० જો હઝરતે ઈમામે હસન ઓર ઈમામે હુસૈન رضي الله تعالى عنهما કે નાનાજાન, હમારે આકા ઓર દોનોં જહાન કે વાલી હૈં યાની અબિલ કાસિમ હઝરતે મુહમ્મદ صل الله تعالى عليه وآله وسلم જો હઝરતે અબ્દુલ્લાહ رضي الله تعالى عنه કે શહઝાદે ઓર અલ્લાહ કે નૂર સે નૂર હૈં ० એ ઉન કે જમાલે જહાં આરા કે દીદાર કા શૌક રખને વાલો ! ઉન પર ઉન કી આલ પર ઓર ઉન કે અસ્હાબ પર દુરુદ ભેજો ઓર સલામ અર્ઝ કરો, જૈસા કે સલામ અર્ઝ કરને કા હક હૈ ०”



या साहिबल-जमालि व या सय्यिदल-भशर
मिं व वज्जिहल-मुनीरि ल-कद् नप्परल-कमर
ला युम्किनुस्सनाठि कमा का-न हक्कुहु
भअद अग् पुदा बुगुर्गा तूथ किस्सा मुप्तसर

“अय साहिबे जमाल और अय धन्सानोंके सरदार
आपके रुपे अन्परसे यांए यमक उठा
आपकी सना का हक अदा करना मुम्किन ही नहीं
किस्सा मुप्तसर येह के, पुदाके बाद आप ही बुगुर्गा हैं.”


- अल्लामा अब्दुर्रहमान जमी

भ-ल-गल-उला भि-कमालिही
क-श-इद् दुजा भि-जमालिही
हसुनत् जमीठि भिसालिही
सल्लू अलैहि व आलिही

“वोह पहुंचे बुलन्दीयों पर अपने कमालके साथ
आपके जमालसे तमाम अंधेरे दूर हो गये
आपकी तमाम आदतें ही अच्छी हैं
आप पर और आपकी आल पर लाजों दुइदो सलाम ”

- अल्लामा शैख सअदी

मिशन का मकसद डोम की जिदमत



हजार बार بشویم دهن به مشك و گلاب
هنوز نام تو گفتن کمال بے ادبیست

“हजार बार अ-शोयम दहन ऋ मुश्को गुलाब
हनूळ नामे वू गुइतन डमाले जे-अदली अस्त”

“हजार बार भी अगर अपना मुंह मुश्को
अर्के गुलाबसे धोऊं, फिर भी आपका
पाकीया नाम लेना
बहुत जली जे-अदली समझता है.”

- अब्बामा अब्दुर्रहमान जमी